

Help Manual for NOC Application

1. Registration

School needs to do Registration prior to apply for NOC as shown below:



The screenshot shows a registration form titled "NOC Application for CBSE" from the Directorate of Primary Education, Government of Gujarat. The form is titled "NOC Registration" and includes the following fields and options:

- Application For :** * Primary
- School Name :** *
- Email Id :** *
- Mobile No :** *
- Board :** *
- Captcha :** *

At the bottom of the form, there are two buttons: "Registration" and "Login".

As the image shows required field to register for application school needs to provide **School Name**, **unique Email ID** and **Mobile No**. By entering captcha user will be able to Register the school.

After hitting the Registration button, School will get Login Credentials on this provided Email Id.

2. Login

After successful registration school can log into application with provided credentials received on registered email id.

The login screen to proceed is as below:



NOC Application for CBSE
Directorate of Primary Education,
Government of Gujarat

Login With Your Credentials

Email Id : *

Password : *

Captcha : *

[Forgot Password ?](#)

Login

Register

3. Payment

School needs to pay the required fees to the DPE before filling an application form.

Using the cyber treasury payment gateway as shown below school will be able to pay fees of INR 1,00,000 as decided.

As described in the below screen, after payment school will be able to check and download the payment receipt as shown below.

Application Payment

Amount of fees to be paid to the Directorate of Primary Education according to the application : 1,00,000

[Continue to Fill Up Application Form](#)

OrderNo	PaymentDate	Amount Paid	Bank	Payment Status	Payment Status
11320210407DPE	07-04-2021	100000.00	SBIEPAY	SUCCESS	Download Receipt

Payment Details

Your Payment has been recieved Successfully as mention below.

Please Note Your Payment ID for any Queries Pertaining to this Transaction.

Payment Date:	07/04/2021	Payment Ref No.:	5800642817810
Paid By:	Primary CBSE		
Bank Name:	SBIEPAY	Order No:	11320210407DPE
Amount Paid:	Rs.100000.00	Status:	SUCCESS
Board:	CBSE	Email ID:	test@test.com

** This is computer generated payslip: No signature is required **

[Print Receipt](#)

[Go Back to Payment Page](#)

4. Application

• Basic Details

Now, School will be able to fill the application form and can attach all required documents.

After Login, please press "Continue to Fill Up the Application" button to proceed further.

You will be redirected to application basic details page as shown in the page below:

Here in the basic details school have to fill the basic details like, School Name and address along with District, Taluka, city, pin code and be careful to select the applicable officer which have options as "DEO" or "DPEO".

Your application will be sent to the selected officer of the selected district.

Then enter all your Trust details along with Trust Registration Certificate as an attachment.

School can add Trustee Details by pressing the add new trustee button where multiple trustee details will be added.

After that, school needs to provide the month and year to start the CBSE school.

Along with these details, school needs to inform whether the application for NOC for other board has been done by school or not. If yes, then needs to upload proof of the same. and one more document needs to be upload if school has got the NOC before by DPE.

NOC Application for CBSE
Directorate of Primary Education,
Government of Gujarat

test@test.com

Application For : Primary

All Application attachments are to be uploaded in PDF Format Only and Images of School Photographs in JPG/JPEG Format Only.

1 Basic Details 2 School Info 3 Area & Land 4 Owner 5 Other Board 6 Financial Capabilities 7 Submission

INFORMATION

શાળાનું નામ: Test Primary 1 (WRITE IN ENGLISH CAPITAL LETTERS)

શાળાનું સરનામું: Enter School Address

શાળાનો જિલ્લો: <-- Select District --> શાળાનો તાલુકો: <-- Select Taluka -->

આપની શાળા કયા અધિકારી ના કાર્યક્ષેત્ર માં આવે છે?: DEO શાળા નો UDISE કોડ: Enter School UDISE Code

શાળાનું ગામ/શહેર: Enter City Name શાળાનો પિનકોડ: Enter Pincode

ટ્રસ્ટ/બોર્ડી રજીસ્ટર્ડ થયેલ છે?: હા ના

ટ્રસ્ટ/બોર્ડી નો પ્રકાર: <-- Select TrustType --> શિક્ષણનો હેતુ ટ્રસ્ટ ડીડ ડોક્યુમેન્ટ માં દર્શાવેલો છે કે નહીં?: હા ના

ટ્રસ્ટ/બોર્ડીનું લેવલ: <-- Select Trust Level --> ટ્રસ્ટ/બોર્ડી કઈ સંસ્થા હેઠળ નોંધાયેલ છે?: <-- Select RegisteredUnder -->

ટ્રસ્ટ/બોર્ડીનો નોંધણી નંબર: Enter Registration Number ટ્રસ્ટ/બોર્ડીની નોંધણીની તારીખ: dd/mm/yyyy

ટ્રસ્ટ/બોર્ડીનું નામ: Enter Trust/Body Name (WRITE IN ENGLISH CAPITAL LETTERS)

ટ્રસ્ટ/બોર્ડીનું સરનામું: Enter Trust/Body Address ટ્રસ્ટ/બોર્ડીનું ઇ-મેલ: Enter Trust/Body E-mail

ટ્રસ્ટ/બોર્ડીનો જિલ્લો: <-- Select District --> ટ્રસ્ટ/બોર્ડીનો તાલુકો: <-- Select Taluka -->

ટ્રસ્ટ/બોર્ડીનું ગામ/શહેર: Enter City Name ટ્રસ્ટ/બોર્ડીનો પીનકોડ: Enter Pincode

ટ્રસ્ટીઓ ના નામ/સરનામા ની વિગતો:

#	Name of Trustee/Member	Designation in Trust/Body	Occupation(if employee, name and address of organization with Designation)	Member in Other Trust/Body	Action
કોઈ રેકોર્ડ મળ્યા નથી.					

સહર શાળાનું જોડાણ કયા બોર્ડ સાથે કરવા માંગો છો?: CBSE સહર શાળા ક્યારથી શરુ કરવા માંગો છો?: <-- Select Month --> 2025

આ શાળાનું અગાઉ અન્ય બોર્ડ સાથે જોડાણ કરાયેલ છે?: હા ના

આ શાળા માટે પ્રા.શિ.મિ.ની કચેરી દ્વારા અગાઉ NOC મેળવેલ છે?: હા ના

NOC: Choose File No file chosen Upload

Save Next Save & Next

© 2021, Directorate of Primary Education All Rights Reserved. Powered By: Guj. Info Petro Ltd.

• School Information

Now, In the second section school needs to provide School Information like, School Type and other miscellaneous documents like Weather the school is valid and if yes attach the proof of validity individually for 1 to 5 standard and 6 to 8 standard. Then after, select yes if permanent registration has been done as per RTE Rules – 2012 and attach proof of such registration.

NOC Application for CBSE
Directorate of Primary Education,
Government of Gujarat

test@test.com

Application For : Primary

All Application attachments are to be uploaded in PDF Format Only and Images of School Photographs in JPG/JPEG Format Only.

1 Basic Details 2 School Info 3 Area & Land 4 Owner 5 Other Board 6 Financial Capabilities 7 Submission

ASSOCIATED WITH DIRECTORATE OF PRIMARY EDUCATION DETAILS

હાલની શાળા માન્ય છે?*	<input checked="" type="radio"/> હા <input type="radio"/> ના	માન્યતાના આધારો (૧ થી ૫) :*	<input type="text" value="Choose File"/> No file chosen	<input type="button" value="Upload"/>
		માન્યતાના આધારો (૬ થી ૮) :*	<input type="text" value="Choose File"/> No file chosen	<input type="button" value="Upload"/>
RTE Rules-૨૦૧૨ ની જોગવાઈ મુજબ કાયમી રજીસ્ટ્રેશન કરાવેલ છે?*	<input checked="" type="radio"/> હા <input type="radio"/> ના	RTE Rules-2012 મુજબ ના રજીસ્ટ્રેશનના આધારો :*	<input type="text" value="Choose File"/> No file chosen	<input type="button" value="Upload"/>
શાળા નો પ્રકાર:*	<input type="radio"/> Self-Finance <input type="radio"/> Grant-in-aid <input type="radio"/> Government			
વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો શાળાએ લાગુ પડેલા બોર્ડમાં તમામ વિદ્યાર્થીઓને સ્થાનાંતરિત કરવા માંગતા હોય તેવા કિસ્સામાં બોર્ડ પરિવર્તનથી સંમત છે?*	<input checked="" type="radio"/> હા <input type="radio"/> ના	વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની સંમતિ નો પુરાવો :*	<input type="text" value="Choose File"/> No file chosen	<input type="button" value="Upload"/>
શાળામાં ચાલતા વર્ગો/ધોરણવાર વિદ્યાર્થી ની સંખ્યા માટેનું પત્રક*	<input checked="" type="radio"/> હા <input type="radio"/> ના	વિદ્યાર્થી ની સંખ્યા માટેનું પત્રક :* (નમૂનો)	<input type="text" value="Choose File"/> No file chosen	<input type="button" value="Upload"/>
શાળામાં ફરજ બજાવતા શિક્ષકોના નામ/વાયકાત/ચુકવાતો પગાર તથા બેંક ખાતા નંબર સાથે ની યાદી આપવી.*	<input checked="" type="radio"/> હા <input type="radio"/> ના	બેંક ખાતા નંબર સાથેની યાદી આપવી.* (નમૂનો)	<input type="text" value="Choose File"/> No file chosen	<input type="button" value="Upload"/>

Previous Save Next Save & Next

© 2021, Directorate of Primary Education All Rights Reserved. Powered By: Guj. Info Petro Ltd.

Additionally, provide consent of students, parents and teachers in form of attachment. Secondly, the document containing count of class wise students as per attached sample needs to be uploaded and details of school teachers with their bank details needed to be uploaded in the same attached sample format.

• Area and Land information

In this section school will fill all the details of school land and area. User will provide information on total school area, plot number, sub plot number and other land related data. Then, if school will select yes in physical facilities, school have to enter details about all classrooms and sanitation.

Moreover, this section will capture the information about water facility and water sources available in the school and water purification facility.

Apart from these, user have to fill up the data of building permission, building map and construction permission details in the current section.

Then after, this sections also asks for fire safety details, whether the school building is right in case of fire and earthquake. Also needs to fill the floor details of school building and provide photograph of school building.

All these information requires several documents which is mentioned in the last page of this document.

NOC Application for CBSE
 Directorate of Primary Education,
 Government of Gujarat

Application For : Primary

1 Basic Details 2 School Info 3 Area & Land 4 Owner 5 Other Board 6 Financial Capabilities 7 Submission

INFORMATION

શાળાનો કુલ જમીન વિસ્તાર in Sq.Meter *	<input type="text"/>	સર્વે નંબર :	<input type="text"/>
બ્લોક નંબર :	<input type="text"/>	પ્લોટ નંબર :	<input type="text"/>
ટી.પી. સ્કોમ નંબર :	<input type="text"/>	ટી.પી. સ્કોમ નામ :	<input type="text"/>
કામનવ પ્લોટ નંબર :	<input type="text"/>	સબ પ્લોટ નંબર :	<input type="text"/>
ટોટલ બિલ્ડ-અપ એરિયા :	<input type="text"/>	નોન બિલ્ડ-અપ એરિયા :	<input type="text"/>
શાળા માટે વપરાયેલ એરિયા :	<input type="text"/>	માર્જિન એરિયા :	<input type="text"/>

શાળાનું જોડણ સંસ્થા/ટ્રસ્ટ જે ઓડિયાથી મેલવવા માંગે છે તે ઓડિ દ્વારા શાળા માટે નિયત કરેલ ક્ષેત્રિય રૂઢિચાઓ ધરાવે છે કે કેમ?

વર્ગીકૃત ની સંખ્યા	ગ્રામ પોલિટ કે તેથી વધુ સ્થળવાળા	ગ્રામ પોલિટ થી બોજા સેવકાવાળા	અન્ય વર્ગબંધો (જો લોપ તો) ની વિગતો
<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>

આધાર્ન ચક્ર છે?	સ્ટાફ રૂમ છે?	ઓફિસ રૂમ છે?	લેબોરેટરી છે?	લાયબ્રેરી છે?	પીવાના પાણી ની સુવિધા છે?
Obl <input type="radio"/> No <input type="radio"/>	Obl <input type="radio"/> No <input type="radio"/>	Obl <input type="radio"/> No <input type="radio"/>	Obl <input type="radio"/> No <input type="radio"/>	Obl <input type="radio"/> No <input type="radio"/>	Obl <input type="radio"/> No <input type="radio"/>

સેનિટરિયલ (સંખ્યા)	કુખાર	રેલિફ
<input type="text"/>	<input type="text"/>	<input type="text"/>

જ્યાં શાળા શરૂ કરવાનો છે તે જગ્યા આરોગ્ય અને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ઉચિત છે?

પીવાના પાણીના સ્ત્રોત :-

પીવાના પાણીના સ્ત્રોત :-

વોટર પ્લોટિફિકેશન કે સિસ્ટમ છે ?

સંસ્થા/ટ્રસ્ટ જે મકાન માં શાળા શરૂ કરવા માંગે છે તે મકાન પાન (નકશા) સહીત ઓર્થોગ્રાફી બે મેટ્રુ કરેલ છે?

ઓર્થોગ્રાફી નામ :-

ઓર્કન નંબર :-

અન્ય વિગતો :-

શાળાના મકાનના બાંધકામની પરવાનગી મેલવેલ છે ?

પાન મેટ્રુ થયેલ કોચ તો થયેલ બાંધકામ માટે સહીત ઓર્થોગ્રાફી દ્વારા વિલ્ડીંગ પુન પરમિશન (જી.યુ.પી) આરેલ છે ?

ઓર્થોગ્રાફી નામ :-

ઓર્કન નંબર :-

અન્ય વિગતો :-

શાળા મકાનમાં કાચર સેક્ટોની સુવિધાઓ ઉપલબ્ધ છે ?

અદ્વિતિયાક સંચાલનો સંખ્યા :-

કચ્છકોમિટી ઓરગાઇઝર :-

કચ્છકોમિટી કચ્છકામ કોના નામે છે ?

શાળાનું મકાન સલામતી અને સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય છે ?

શાળાનું મકાન કોવિડ નોએકશન કે કોવિડ સેન્ટર માં આરેલ છે ?

શાળાનું મકાન સલામતી અને સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય છે કે કેમ(આબચ, જુદા પાણી આપતો માં)

શાળાનું મકાન કેટલા માલનું છે ?

શાળાના વિદ્યાર્થીઓને 6 = 2 યુધીના માલ પર બેસાડવામાં આરેલ છે ?

વોટર સંપત્તિ એરિયા in Sq.Meter :-

શાળાના મકાનનો નકશો :-

વોટર તારોખ :-

વિલ્ડીંગ નો કેવુ :-

શાળર સેક્ટો અંગેનું પ્રમાણપત્ર :-

અન્ય વિગતો :-

કચ્છકોમિટી રજીસ્ટ્રેશન નંબર :-

જુદા પુ પાણી અને માન્ય સુક્રમલ બેન્કનોબનુ પ્રમાણપત્ર :-

કોરોના :-

Previous Save Next Save & Next

• Land Owner Details

Basically this section will capture information about School Land Ownership information. First detail required here is the owner details, like whether the school and playground land ownership is of trust or not. Based on that user requires to upload proof of ownership or rent agreement in case the land is not owned by trust.

Secondly, School has to inform if the land is Non Agricultural or not and attach required documents for the same.

And in last, provide information like school is at safe distance from hazardous elements like Oil/Gas Pipeline, Electricity (High-tension) Line or not. Furthermore, provide information that any local laws are affected or not if school will get NOC to get started.

Application For : Primary

All Application attachments are to be uploaded in PDF Format Only and Images of School Photographs in JPG/JPEG Format Only.



INFORMATION

શાળા અને રમત-ગમતના મેદાનના મલિક એક જ છે ? *	<input type="radio"/> હા <input type="radio"/> ના			
શાળાના મકાનની માલિકી ટ્રસ્ટની છે? *	<input type="radio"/> હા <input type="radio"/> ના	રજીસ્ટર્ડ ભાડા કરાર : *	<input type="button" value="Choose File"/> No file chosen	<input type="button" value="Upload"/>
શાળાના મકાનની માલિકી કોની છે? *	<input type="text"/>	માલિકી ના આપારો : *	<input type="button" value="Choose File"/> No file chosen	<input type="button" value="Upload"/>
રમત-ગમતના મેદાનની માલિકી ટ્રસ્ટની છે? *	<input type="radio"/> હા <input type="radio"/> ના	રજીસ્ટર્ડ ભાડા કરાર : *	<input type="button" value="Choose File"/> No file chosen	<input type="button" value="Upload"/>
રમત-ગમતના મેદાનની માલિકી કોની છે? *	<input type="text"/>	માલિકી ના આપારો : *	<input type="button" value="Choose File"/> No file chosen	<input type="button" value="Upload"/>
રમત-ગમતના મેદાનનું ક્ષેત્રફળ પર્યાપ્ત છે? *	<input type="radio"/> હા <input type="radio"/> ના	રમત-ગમતના મેદાનનું ક્ષેત્રફળ (ચો. મી.) : *	<input type="text"/>	
રમત-ગમતનું મેદાન શાળાના કેમ્પસ ની અંદર જ છે ? *	<input checked="" type="radio"/> હા <input type="radio"/> ના			
શાળા ના મકાન ની જમીન એન.એ ઘણેલ છે? *	<input checked="" type="radio"/> હા <input type="radio"/> ના <input type="radio"/> વાણી ૫૬૫	જમીન એન.એ (બિનખેતી) હુકમની નકલ : *	<input type="button" value="Choose File"/> No file chosen	<input type="button" value="Upload"/>
એરિયા in Sq.Meter *	<input type="text"/>	ઓફિસ નંબર : *	<input type="text"/>	
ઓફિસ તારીખ : *	<input type="text" value="dd/mm/yyyy"/>	એન.એ જમીનનો હેતુ : *	<input type="text" value="Select Purpose"/>	
રમત-ગમતના મેદાન ની જમીન એન.એ ઘણેલ છે? *	<input checked="" type="radio"/> હા <input type="radio"/> ના <input type="radio"/> વાણી ૫૬૫	જમીન એન.એ (બિનખેતી) હુકમની નકલ : *	<input type="button" value="Choose File"/> No file chosen	<input type="button" value="Upload"/>
એરિયા in Sq.Meter *	<input type="text"/>	ઓફિસ નંબર : *	<input type="text"/>	
ઓફિસ તારીખ : *	<input type="text" value="dd/mm/yyyy"/>	એન.એ જમીનનો હેતુ : *	<input type="text" value="Select Purpose"/>	
શાળાનું મકાન/રમત-ગમતનું મેદાન હાનિકારક તત્વો જેવા કે ઓઇલ/ગેસ પાઇપલાઇન, ઇલેક્ટ્રીસિટી (HighTension) વાઇર થી સલામત અંતર છે ? *	<input type="radio"/> હા <input type="radio"/> ના			
જ્યાં શાળા શરુ કરવી છે તે સ્થળે પૂરતી જગ્યા ઉપલબ્ધ છે? *	<input type="radio"/> હા <input type="radio"/> ના			
શાળા શરુ કરવાથી સ્થાનિક કાયદાઓના અમલ માં કોઈ બાધ આવે છે ? *	<input type="radio"/> હા <input type="radio"/> ના			

Previous Save Next Save & Next

• Other Board Details

This tab will ask you about other board details for the same school.

Application For : Primary

All Application attachments are to be uploaded in PDF Format Only and Images of School Photographs in JPG/JPEG Format Only.



INFORMATION

શું ટ્રસ્ટ અન્ય બોર્ડ સાથે કોઈ શાળા ચલાવી રહ્યું છે? *	<input checked="" type="radio"/> હા <input type="radio"/> ના	માન્યતા નું પ્રમાણપત્ર : *	<input type="button" value="Choose File"/> No file chosen	<input type="button" value="Upload"/>
સુવિત શાળા મકાનમાં કોઈ ઉચ્ચ શિક્ષણ કે ઓધોગિક સંસ્થા ચાલે છે? *	<input checked="" type="radio"/> હા <input type="radio"/> ના	સંસ્થા ની વિગતો : *	<input type="text"/>	
શું ટ્રસ્ટ પાસે અન્ય બોર્ડ સ્કૂલ / ઉચ્ચ શિક્ષણની સંસ્થા ચલાવવા માટે રાજ્ય સરકારની એન.ઓ.સી. છે? *	<input checked="" type="radio"/> હા <input type="radio"/> ના	રાજ્ય સરકારના એન.ઓ.સી.નો પુરાવો : *	<input type="button" value="Choose File"/> No file chosen	<input type="button" value="Upload"/>

Previous Save Next Save & Next

First of all, answer if any other board is running for the same school or not and attach required document. Then provide information on any other higher education or industrial institute is running the same building or not. Also provide information about NOC to run the other board is any with appropriate document.

• Financial Capabilities

This section required details about the financial capacity of school trust which requires C.A certification for source of income and capacity.

Apart from these, user will have to agree on some of the beherry like to follow the state government schemes, wants to run other board syllabus after getting NOC for CBSE and have consent on giving admission on basis of RTE Act 2009 and 12.1C section.

NOC Application for CBSE
Directorate of Primary Education,
Government of Gujarat

test@test.com

Application For : Primary

All Application attachments are to be uploaded in PDF Format Only and Images of School Photographs in JPG/JPEG Format Only.

1 Basic Details 2 School Info 3 Area & Land 4 Owner 5 Other Board 6 Financial Capabilities 7 Submission

INFORMATION

શાળા સંચાલક મંડળની આર્થિક સહયોગ કેટલી છે ? *	<input type="text"/>	સી. એ. સર્ટિફિકેટ :*	<input type="text" value="Choose File"/> No file chosen	<input type="button" value="Upload"/>
સંસ્થા / ટ્રસ્ટની આવક ના સ્ત્રોત ક્યા છે ? *	<input type="text"/>	સી. એ. સર્ટિફિકેટ :*	<input type="text" value="Choose File"/> No file chosen	<input type="button" value="Upload"/>
રાજ્ય સરકાર ની યોજનાઓનો અમલ આ શાળાઓએ નિહા પૂર્વક કરવાનો રહેશે, તે બાબતની બાહેધરી આપેલ છે ? *	<input checked="" type="radio"/> હા <input type="radio"/> ના	બાહેધરી પત્ર :*	<input type="text" value="Choose File"/> No file chosen	<input type="button" value="Upload"/>
શાળા મંડળ આજ શાળા મકાન માં CBSE નું જોડાણ મેળવ્યા પછી અન્ય બોર્ડ ની અભ્યાસક્રમ ચલાવવા માંગે છે ? *	<input checked="" type="radio"/> હા <input type="radio"/> ના			
શાળા RTE Act 2009 ની કલમ 12.1C હેઠળ પ્રવેશ આપવા સંમત છે ? *	<input checked="" type="radio"/> હા <input type="radio"/> ના			
સદર શાળા વધુમતી છે ? *	<input checked="" type="radio"/> હા <input type="radio"/> ના			
પ્રા.શિ.નિ / NCMEI Delhi નું વધુમતી દરજ્જાનું પ્રમાણપત્ર મેળવેલ છે ? *	<input checked="" type="radio"/> હા <input type="radio"/> ના	વધુમતી દરજ્જાનું પ્રમાણપત્ર :*	<input type="text" value="Choose File"/> No file chosen	<input type="button" value="Upload"/>

© 2021, Directorate of Primary Education All Rights Reserved. Powered By: Guj. Info Petro Ltd.

Additionally, answer if the School will be in Minority or not, if yes then provide Minority Certificate received from DPE/NCMEI Delhi.

• Submission

And lastly, application submission sections require various photograph of the school. Also after verifying all the information school will be able to submit the application by providing the name of trust and trustee and uploading the signature of the head.

But before submitting an application School will have to verify that all information is correct at their end because after submitting an application school will not be able to modify any detail.

Application For : Primary

All Application attachments are to be uploaded in PDF Format Only and Images of School Photographs in JPG/JPEG Format Only.



INFORMATION

શાળાના મકાન ના (અંદરના તેમજ બહારના કપર)ફોટો રજૂ કરવા

1. Front-Side*	Choose File	No file chosen	Upload	2. Back-Side*	Choose File	No file chosen	Upload
3. Left-Side*	Choose File	No file chosen	Upload	4. Right-Side*	Choose File	No file chosen	Upload
5. School Building (along with Wall)*	Choose File	No file chosen	Upload	6. School View from Gate*	Choose File	No file chosen	Upload
7. School Playground*	Choose File	No file chosen	Upload				

Previous Save

- આથી હું પ્રમાણપત્ર આપું છું કે ઉપર જણાવેલ તમામ હકીકતો ખરી છે જેની મેં જાતે ખાતરી કરી છે.કોઈપણ હકીકત ઠોષયુક્ત જણાય કે ખોટી સાબિત થાય તો અમારી સંસ્થાને આપેલ એન.ઓ.સી રદ કરી, શાળાની નોંધણી રદ કરવા સહિતની કાર્યવાહી થઇ શકે છે, તે અમો જાણીએ છીએ.
- આથી અમારું શાળા મંડળ બાંહેધરી આપે છે કે, ગુજરાત સ્વ નિર્ભર શાળાઓ (ફી નિયમન) અધિનિયમ ૨૦૧૭, RTE Act ૨૦૦૯, ગુજરાત RTE Rules ૨૦૧૨, સ્કૂલ સેફ્ટી પોલિસી ૨૦૧૬, રાજ્ય સરકાર / શિ. વિભાગ ના વખતો વખત ના ઠરાવ / પરિપત્ર / નીતિ ના અમલ ની તથા શિક્ષકોની વાચકાત, પગાર વોરણ, વિદ્યાર્થી પ્રવેશ, પરીક્ષા, વિષયો, પાઠ્યપુસ્તકો, અભ્યાસક્રમ ના નિયમાનુસાર અમલ ની બાંહેધરી આપે છે.
- G +2 કરતા વધુ ના માળે પ્રા.શાળા ના વિદ્યાર્થીઓ ને બેસાડવામાં આવશે નહીં, તેની બાંહેધરી આપવામાં આવે છે.

તારીખ :- *	<input type="text"/>	શાળા સંચાલક મંડળનું નામ :- *	<input type="text"/>
શાળા સંચાલક મંડળ ના પ્રમુખ/મંત્રીનું નામ :- *	<input type="text"/>	શાળા સંચાલક મંડળ ના પ્રમુખ/મંત્રી ની સહી :- *	Choose File No file chosen Upload
સ્થળ :- *	<input type="text"/>		

Submit Application

After submit user will be redirected to the page where they will get details about the officer who will verify and forward their application. Here, user can check status any time with provided login credentials.

After successful approval School will be able to download Approval Letter from this login only.

NOC Application

APPLICATION STATUS

Application Number	NOC/20/P/0001
Application For Board	Central Board of Secondary Education
Application Type	Primary
Email ID	test@test.com
School Name :	Test Primary 1
Application at :	DPEO Test On 07/04/2021
Application Status :	In Process

List of Documents:

- ❖ Trust/Body Registration Certificate
- ❖ Other Board NOC (if applicable)
- ❖ NOC from DPE (if Applied previously)
- ❖ Validity Proof (standard 1 to 5)
- ❖ Validity Proof (standard 6 to 8)
- ❖ Proof of Registration as per RTE Rules – 2012
- ❖ Consent Letter from Students, parents and Teachers
- ❖ List of Student as per attached Sample
- ❖ List of Teachers with Bank Account Details as per attached Sample
- ❖ MAP of School Building
- ❖ Construction Permission Certificate of Building
- ❖ B.U.P Certificate
- ❖ Fire-safety Certificate
- ❖ ELCB Certificate (Earthquake Proof Building Certificate)
- ❖ School Floor Photograph
- ❖ Ownership Proof/ Rent Agreement for School Land
- ❖ Ownership Proof/ Rent Agreement for School Playground Land
- ❖ Copy of School Land N.A (Non Agriculture)
- ❖ Copy of School Playground Land N.A (Non Agriculture)
- ❖ Other Board Validity Certificate (if running other board school)
- ❖ State Government NOC Proof (if running other board school)
- ❖ C.A Certificate for Financial Capability of School Trust
- ❖ C.A Certificate for Source of Income of School Trust
- ❖ Minority Certificate from DPE/NCMEI Delhi (if Applicable)
- ❖ Various School Photographs including
 - Front-Side of School
 - Back-Side of School
 - Left-Side of School
 - Right-Side of School
 - School Building (along with wall)
 - School View from Gate
 - School Playground